



FRANKLIN TEMPLETON

આપણા પ્રેસિડન્ટનો પત્ર

23 નવેમ્બર, 2020

પ્રિય યુનિટધારક,

છેલ્લા થોડા દિવસોમાં તમારા માના ઘણાએ અમે હવે શું પગલાં લેવા માગીએ છીએ તે જાણવા માટે અમારો સંપર્ક કર્યો હતો. તમે જાણો છો તેમ ટ્રસ્ટી ઓફ ફ્રેન્કલીન ટેમ્પલ્ટને એપ્રિલ 2020માં અમારા 6 દેવા ફંડઝ બંધ કરી દેવાનું નક્કી કર્યું હતું. કોરોનાવાયરસ લોકડાઉનને કારણે થયેલી તીવ્ર અસર, યુનિટધારકો દ્વારા કરવામાં આવેલા સતત રિડીમ્પશન્સને કારણે ફંડોમાં રહેલી જામીનગીરીઓ નોંધપાત્ર ડીસ્કાઉન્ટ સાથે વેચાણમાં પરિણમી હતી અને તેના લીધી એનએવીમાં પણ તીવ્ર ઘટાડો થતા બજાર અત્યંત તરલ બની ગયું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ ટ્રસ્ટીઓએ તણાવભર્યા રિડીમ્પશન્સથી યુનિટધારકોને થતા નુકસાનથી બચાવવા માટે આ છ ફંડોને બંધ કરવાનો કપરો નિર્ણય લીધો હતો.

મે 2020માં ટ્રસ્ટીઓએ સેબી મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશન્સની કલમ 41(1) હેઠળ ફંડોમાં રહેલી દેવા જામીનગીરીઓને કમબક્ક વેચાણ કરવા દેવા માટે ટ્રસ્ટીઓ(અથવા ડેલોઇટ)ને મંજૂરી આપવા અને યુનિટધારકોને નાણાં પરત આપવા માટે યુનિટધારકો પાસેથી મત માગ્યો હતો. જોકે તે પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી.

સ્કીમ્સ સક્રિય રીતે પોર્ટફોલિયોનું નાણામાં રૂપાંતર કરી શકી નહીં હોવાથી છ સ્કીમોમાંથી ચારમાં આશરે રૂ. 5,900 કરોડ જ વિતરણ કરવા માટે ઉપલબ્ધ છે. તે બતાવે છે કે જો સ્કીમ્સને વેચાણની કમબક્ક પ્રક્રિયા હાથ ધરવાની મંજૂરી આપવામાં આવે, તો જ ફંડઝમાં રહેલી જામીનગીરીઓનું વાજબી રીતે વેચાણ કરી શકાય. જો સામાન્ય માર્કેટ પરિસ્થિતિ હેઠળ જામીનગીરીઓના રિડીમ્પશનનો ધસારો જામીનગીરીઓના રિયલાઇઝ વેલ્યુ કરતા અત્યંત નીચા ભાવે તાત્કાલિક વેચાણ કરવાની ફરજ પડશે તો જામીનગીરીઓનું ડીસ્ટ્રેસ સેલ (તીવ્ર ડીસ્કાઉન્ટ પર) કરવું ચોક્કસપણે સાડુ ગણાશે.

માનનીય કર્ણાટક હાઇકોર્ટના ચૂકાદા બાદ, અમે વ્યવસ્થિત રીતે ટૂંકા શક્ય સમયગાળામાં યુનિટધારકોને નાણાં પરત આપવાનું શરૂ કરવા માટે છેલ્લા બેથી ત્રણ સપ્તાહો સુધી તમામ શક્ય વિકલ્પો વિચાર્યા હતા. તેમાં માનનીય હાઇકોર્ટના ચૂકાદા અનુસાર યુનિટધારકની સંમતિ લેવાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે.

આમ છતાં લાંબી વિચારણા બાદ, અમે નક્કી કર્યું છે કે યુનિટધારકોના શ્રેષ્ઠ હિતમાં કાયદાનું યોગ્ય રીતે અમલીકરણ થાય તે માટે માનનીય સુપ્રીમ કોર્ટની ન્યાયિક દરમિયાનગીરી આવશ્યક રહેશે. આ પગલાંને થોડો સમય લાગશે કેમ કે જો રિડીમ્પશન્સમાં ધસારો થાય તો તે કિસ્સામાં જામીનગીરીઓનું ડીસ્ટ્રેસ વેચાણ (ભારે ડીસ્કાઉન્ટ પર) વિના સમાન રીતે વહેલામાં વહેલી તકે યુનિટધારકોને અમે નાણાં પરત આપી શકીએ તેની ખાતરીરૂપે આ પગલાં કાળજીપૂર્વક અને વિચારપૂર્ણ રીતે

લેવા પડશે.

વહેલામાં વહેલા શક્ય સમયે યુનિટધારકોને સ્કીમના સમાન વિતરણની ખાતરી કરવાની ટ્રસ્ટીઓની ઇચ્છા છે અને પ્રયત્ન પણ રહેશે. આ દિશામાં જો કોઈ પ્રગતિ થશે તો અમે તમને જાણ કરીશું. દરમિયાનમાં મારી ટીમ અને હું તમને જો કોઈ પ્રશ્ન હોય તો તેના જવાબ આપવા માટે હાજર છીએ. આ પડકારજનક સમયમાં પણ તમારા સતત સમર્થન બદર ફરી એક વાર આપનો આભાર માનુ છું.

કૃપા કરીને સુરક્ષિત અને તંદુરસ્ત રહેશો

આપનો નિષ્ઠાવાન,

સંજય સપ્તે

પ્રેસિડન્ટ, ફ્રેન્ક્લીન ટેમ્પલ્ટન એસેટ મેનેડમેન્ટ (ઇન્ડિયા) પ્રા. લિમીટેડ

ડીસક્લેઇમર

આ સંદેશાવ્યવહારમાં સમાવિષ્ટ માહિતી એ દરેક ભૌતિક તથ્યોનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ નથી અને માત્ર માહિતીના હેતુ માટે છે. આ સંદેશાવ્યવહારમાં નિવેદનો / મંતવ્યો / ભલામણો જેમાં શબ્દો અથવા શબ્દસમૂહો છે જેમ કે "ઇચ્છા", "અપેક્ષા", "શક્યતા", "વિશ્વાસ કરો" અને સમાન અભિવ્યક્તિઓ અથવા આવા અભિવ્યક્તિઓના ભિન્નતા "ફોરવર્ડ લૂકીંગ નિવેદનો" છે. વાસ્તવિક પરિણામો ભૌતિક રીતે જોખમો અથવા અનિશ્ચિતતાઓને કારણે આપણી અપેક્ષાઓ સાથે સંકળાયેલા જોખમો અથવા અનિશ્ચિતતાને કારણે સૂચવેલા સૂચનોથી ભિન્ન હોઈ શકે છે, પરંતુ બજારના જોખમના સંસર્ગમાં, ભારત અને વૈશ્વિક સ્તરે અન્ય દેશોમાં સામાન્ય આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓ, જે મર્યાદિત નથી. સેવા અને/અથવા રોકાણો પર અસર પડે છે. આ સંદેશાવ્યવહારની તારીખ પછીની સલામતીને અસર કરતી બાબતોમાં બદલાવ આવી શકે છે. એએએમસી, ટ્રસ્ટી, તેમના સહયોગીઓ, અધિકારીઓ અથવા કર્મચારીઓ અથવા હોલ્ડિંગ કંપનીઓ કોઈ વળતરની ખાતરી આપતી નથી અથવા બાંહેધરી આપતી નથી. આ યોજનાઓમાં રોકાણ પર સિદ્ધાંત અથવા આવકની ખાતરી. કૃપા કરીને કોઈ રોકાણ નિર્ણય લેતા પહેલા સ્કીમના માહિતી દસ્તાવેજને સંપૂર્ણ રીતે કાળજીપૂર્વક વાંચો અને વધુ વિગતો માટે અમારી વેબસાઇટ <http://www.franklintempletonindia.com> ની મુલાકાત લો.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધિન છે, યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.